

Press Release

સ્વરાજ ટ્રેક્ટર્સ બાગાયતી કૃષિને મિકેનાઇઝેશન માર્ગે અગ્રેસર કરશે

- બાગાયતી ખેડૂત માટે નવીન અને વાજબી ફાર્મ મિકેનાઇઝેશન સોલ્યુશન CODE પ્રસ્તુત કર્યું
- ઉદ્યોગમાં સૌપ્રથમ ડ્યુઅલ ગ્રાઉન્ડ ક્લીઅરન્સ અને બાય-ડાયરેક્શનલ ડ્રાઇવિંગ જેવી ખાસિયતો સાથે વિવિધતાસભર બહુ-ઉદ્દેશી રાઇડ-ઓન મશીન, ડિઝાઇન અને વજનમાં નાનું અને હળવું

મોહાલી, 11 નવેમ્બર, 2021: મહિન્દ્રા ગ્રૂપની કંપની સ્વરાજ ટ્રેક્ટર્સે આજે ભારતમાં બાગાયતી ખેતીમાં પરિવર્તન લાવવા માટે પરિવર્તનકારક નવું બહુઉદ્દેશી ફાર્મ મિકેનાઇઝેશન સોલ્યુશન CODE પ્રસ્તુત કર્યું હતું.

સ્વદેશી ડિઝાઇન ધરાવતું ફાર્મ મિકેનાઇઝેશન સોલ્યુશન CODE બાગાયતી કૃષિમાં સંકળાયેલી મજૂરીને દૂર કરવાના વિચાર સાથે વિકસાવવામાં આવ્યું છે. સૌથી સાંકડું અને વજનમાં હળવું રાઇડ-ઓન મશીન CODE ભારતમાં બાગાયતી ખેતીમાં પરિવર્તનનો પવન ફૂંકશે, જે ખેડૂતોને વિવિધ શાકભાજી અને ફળફળાદિના પાકો માટે સાંકડી હરોળમાં ઈન્ટર-ક્લચર કામગીરી હાથ ધરવાની સુવિધા આપશે. ઉપરાંત આ મશીનની ટૂંકી ટર્નિંગ ટ્રિજલ્યા બાગાયતી પાક લેતા નાનાં ખેડૂતોમાં શ્રેષ્ઠ મેનુવેરિબિલિટી પ્રદાન કરશે.

બાગાયતી સેગમેન્ટમાં CODE લોંચ કરવા પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઈક્વિપમેન્ટ સેક્ટરના પ્રેસિડન્ટ હેમંત સિક્કાએ કહ્યું હતું કે, “છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતની કૃષિ જીડીપીમાં બાગાયતી ખેતીનો હિસ્સો વધવાની સાથે ઉત્પાદકતામાં વધારો કરવા આ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરૂર છે. સ્વરાજ દ્વારા CODE નવીન ફાર્મ મિકેનાઇઝેશન સોલ્યુશન છે, જે મહિન્દ્રા ફાર્મ ઈક્વિપમેન્ટ સેક્ટરના ‘ખેતીમાં પરિવર્તન લાવવા અને જીવનને સમૃદ્ધ કરવાના’ ઉદ્દેશ સાથે સુસંગત છે. CODE પ્રસ્તુત કરવાનો અમારો ઉદ્દેશ ખેડૂતોને વાજબી અને નવીન ટેકનોલોજી સરળતાપૂર્વક સુલભ પ્રદાન કરવાનો છે.”

આ નવા લોંચ વિશે સ્વરાજ ટ્રેક્ટર્સના સીઈઓ હરિશ ચવ્વાણે કહ્યું હતું કે, “આપણા દેશમાં બાગાયતી ખેતી મિકેનાઇઝેશન માટે મોટી તક ધરાવે છે. સ્વરાજ દ્વારા CODE ગ્રાહકોની જરૂરિયાતોનો અભ્યાસ કરીને અને બાગાયતી ખેતીમાં ખેડૂતોની જરૂરિયાતોનો વિચાર કરીને ખાસ વિકસાવવામાં આવેલું મશીન છે. અત્યાર સુધી આ સેગમેન્ટમાં માનવીય અને પશુઓના શ્રમની બહુ જરૂર છે અને આ નવીન સોલ્યુશન આ સેગમેન્ટમાં મિકેનાઇઝેશન લાવવાની દિશામાં પથપ્રદર્શક પગલું છે.”

વિશિષ્ટ ક્ષમતાઓ સાથે CODE બાગાયતી ખેતી સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદ કરશે અને ‘**ખેતી કી દુનિયા કા સબસે પેહલા યસ મશીન**’ ગણાય છે, ત્યારે બાગાયતી ખેડૂતને ઉદ્યોગમાં કેટલાંક સૌપ્રથમ ફાયદા આપે છે. કેટલીક મુખ્ય ખાસિયતોમાં સામેલ છે:

ડ્યુઅલ ગ્રાઉન્ડ ક્લીઅરન્સ – પાકની ઊંચાઈ વધવાની સાથે મશીનનું ગ્રાઉન્ડ ક્લીઅરન્સ વધારી શકાશે, જેથી માનવીય કામગીરી પર નિર્ભરતામાં ઘટાડો થશે.

બાય-ડાયરેક્શનલ ડ્રાઇવિંગ – બાય-ડાયરેક્શનલ સુવિધા મશીનના આગળના ભાગમાં એટેચમેન્ટ્સ સાથે કામગીરી કરવા સક્ષમ બનાવશે, જે એને ડાંગરમાં લાણુણીની કામગીરી માટે અતિ સુવિધાજનક બનાવે છે.

CODE શરૂઆતમાં ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સ્વરાજની ડિલરશિપમાં પ્રસ્તુત થશે તથા ટૂંક સમયમાં તબક્કાવાર રીતે અન્ય તમામ રાજ્યોમાં પ્રસ્તુત થશે. આ પ્રોડક્ટ માલિકીના સરળ અનુભવ માટે સુનિશ્ચિત સર્વિસ સપોર્ટ પણ આપશે. **About Swaraj**

Swaraj Tractors a division of Mahindra Group is India's second largest and fastest growing tractor brand. Established in 1974, based in Punjab, the grain bowl of India, Swaraj is a brand that is made by the farmer, for the farmer as many of its employees are also farmers. They bring real world performance and create an authentic, powerful product with assured performance and enduring quality, designed with one purpose – enabling the Indian farmer to Rise. Swaraj Tractors manufactures tractors in the range of 15HP to 65HP and also provides complete farming solutions.

Learn more about Swaraj Tractor on www.swarajtractors.com/

About Mahindra

Founded in 1945, the Mahindra Group is one of the largest and most admired multinational federation of companies with 260,000 employees in over 100 countries. It enjoys a leadership position in farm equipment, utility vehicles, information technology and financial services in India and is the world's largest tractor company by volume. It has a strong presence in renewable energy, agriculture, logistics, hospitality and real estate.

The Mahindra Group has a clear focus on leading ESG globally, enabling rural prosperity and enhancing urban living, with a goal to drive positive change in the lives of communities and stakeholders to enable them to Rise.

Learn more about Mahindra on www.mahindra.com / Twitter and Facebook: @MahindraRise/ For updates subscribe to <https://www.mahindra.com/news-room>

Media contact information

Arthur Serrao & Shruti Chhabra
Communications Team
Mahindra & Mahindra Ltd.
Email: serrao.arthur@mahindra.com & chhabra.shruti@mahindra.com